

Current Affairs

August- (2021)

www.gnanbhandar.com

World

- ▶ અમેરીકામાં મેનહટનની ગ્રાન્ટ જયુરી દ્વારા બે વર્ષની તપાસ પછી પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ધ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન તેમજ તેના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર એલન વેસલબર્ગને ટેક્સ કાઇમમાં દોષિત ઠરાવવામાં આવ્યા છે.
- ▶ અમેરિકા ના ઉત્તર નેવાડાની વોશૂ કાઉન્ટીએ ડેલ્ટા વેરિયન્ટથી પ્રથમ મૃત્યુની પુષ્ટિ કરી.
- ▶ નેપાળમાં વચગાળાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 15 થી 30 જુલાઇ વચ્ચે ચૂંટણીપંચને પોતાની ઉમેદવારી રજીસ્ટર કરવવાની રહેશે. બે ચરણમાં ચૂંટણી થશે જેમાં પ્રથમ રાઉન્ડ 12 નવેમ્બર અને બીજો રાઉન્ડ 22 નવેમ્બરે ચૂંટણી યોજાશે.
- ▶ ‘ ધ હંગ્રી વાઇરસ મલ્ટીપ્લીસના રિપોર્ટ અનુસાર ભૂખથી વિશ્વમાં દર મિનિટે 11 લોકોના મોત થાય છે. અને 15 કરોડથી વધુ લોકો ભૂખમરાના સંકટ હેઠળ જીવી રહ્યા છે.
- ▶ અમેરીકામાં આવેલા લ્યુસિયાની 14 વર્ષીય ઝેલા એવાંટ ગાર્ડ અમેરિકાની પ્રતિષ્ઠિત સ્પેલિંગ સ્પર્ધા જીતનાર પહેલી આફ્રિકી અમેરિકન બની. આ સ્પર્ધાના 93 વર્ષના ઇતિહાસમાં કોઈ અશ્વેત આ સ્પર્ધા જીત્યું છે.

ચેપી રોગ છે ક્ષેત્રે તે સંક્રમિત પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે. WHO સંસ્થા અનુસાર આ વાયરસ અમેરિકા, બ્રિટન અને નાઇજીરિયા સહિત વિશ્વના 15 દેશોમાં મનુષ્યોમાં જોવા મળ્યો છે. અત્યારે આ રોગની કોઈ સારવાર નથી.

▶ અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા સ્થાપવા માટે એક નવો સમૂહ Quad (ક્વોડ)સમૂહ બનાવવામાં આવશે. આ સમૂહમાં અમેરિકા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉરુબેકિસ્તાનનો સમાવેશ કરવામાં આવશે. અગાઉ ચીન તરફથી હિંદ પ્રશાંત ક્ષેત્રમાં થતી સમસ્યાઓથી લડવા માટે ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા દ્વારા આ પ્રકારનું સંગઠન બનાવવામાં આવ્યું હતું.

▶ ચીને પ્રતિ કલાક 600 KMPH ઝડપથી દોડતી મેગ્નેટ ટ્રેનનું લોકાર્પણ કર્યું. આ ટ્રેન વિદ્યુત ચુંબકીય બળની મદદથી પોતાના ટ્રેકથી ઉપર તરતી હોય છે જેને લીધે તેને ‘ ફ્લોટિંગ ટ્રેન’ તરીકે પણ ઓળખાય છે. ચીને આ અગાઉ 2003માં ટ્રેન શરૂ કરી હતી અને તેની ઝડપ 413KMPH હતી.

▶ હૈતીના નવા પ્રધાનમંત્રી તરીકે એરિયલ હેનરીએ શપથ ગ્રહણ કર્યા. જેઓ હાલમાં હૈતીના રાષ્ટ્રપતિ પણ છે.

► ઇઝરાયલ કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. ઇઝરાયલ સરકાર દ્વારા કોરોના વેક્સિન ફાઇઝર- બાયોએનટેકની રસીનો ડોઝ આપે છે.

► કોરોનાનો થર્ડ વેવ બાળકો માટે પ્રાણઘાતક નીવડશે તેવી આગાહી સાચી પડશે તેવું લાગે છે. ઇન્ડોનેશિયામાં કોરોના વાઇરસને કારણે દર અઠવાડિયે 100 બાળકોને ભરખી રહ્યો હોવાના અહેવાલ છે. ઇન્ડોનેશિયામાં કોરોનાના કુલ કેસોમાં 12.5% બાળકો છે.

National/ ભારત

► ભારતની મશહૂર મ્યુઝિક કંપની T-Seriesના સ્થાપક ગુલશનકુમારની હત્યાના લગભગ 24 વર્ષ અને ટ્રાયલ કોર્ટના ચુકાદાના 19 વર્ષ બાદ આ કેસમાં બોમ્બે હાઇ કોર્ટે શાર્પશૂટર અને દાઉદ ઇબ્રાહિમના સાગરીત ગણાતા રઉફ મર્યન્ટને દોષિત જાહેર કરવાના સેશન કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે યથાવત રાખ્યો છે. અને આ કેસમાં બીજો આરોપી નિર્દોષ છૂટેલા અબ્દુલ રશિદને આજીવન કેદ સજા સાંભળવી છે.

► ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ શિપ્લાને ઈમરજન્સી ઉપયોગ માટે મોર્ડનાની કોવિડ-19 રસીને આયાત કરવાની મંજૂરી આપી. કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક-વી પછી મોર્ડના ભારતમાં ઉપલબ્ધ થનાર ચોથી રસી હશે.

► દેશમાં ગર્ભવતી મહિલોને પણ કોરોનાની રસી આપવા માટે આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી. સર્ગભાઓ હવે કોવિન પર નોંધણી કર્યા પછી તથા સીધા કોરોના રસીકરણ કેન્દ્રમાં જય રસી લગાવી શકે છે.

SBI નો ' ધ રેસ ટુ ફિનિશિંગ લાઇન'નો રિપોર્ટ

→કોવિડ-19 ' ધ રેસ ટુ ફિનિશિંગ લાઇન' નામના અહેવાલ મુજબ કોરોના મહામારી સામે વચાવ માટે વેક્સિન જ મહત્વનું હથિયાર રહેશે.

→કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના બીજા પખવાડિયાથી વધવાની શરૂઆત થશે અને ઓછામાં ઓછું એક મહિના પછી તેની પીકબનશે.

→SBIના ગ્રૂપ ચીફ ઇકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષના વૈશ્વિક ડેટા મુજબ બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેરના પીક કેસ 1.7 ગણા રહેવાનો અંદાજ છે.

► દિલ્લીમાં ભાજપ પક્ષ પ્રમુખ જે.પી.નડા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે લાંબી ચર્ચા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તિરથસિંહ રાવતે રાજીનામું આપ્યું. રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામીની વરણી કરવામાં આવી.

► મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસા સત્ર સરમિયાન ઓબીસી આરક્ષણ મૂદે કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવ સાથે ગેરવર્તણૂક બદલ ભાજપના ૧૨ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

► નાણાં વિભાગ દ્વારા વેરા સમાધાન યોજના- ૨૦૧૯ની મુદતમાં વધારો કરીને ૩૧મી ઓગસ્ટ ૨૦૨૧ કરવામાં આવી છે.

► ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસનાં દિગ્ગજ દિવંગત નેતા પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)નો રિપોર્ટ

→ભારતની સંપૂર્ણ સ્વદેશી વેક્સિન કોવેક્સિન ડેલ્ટા અને આલ્ફા બને વેરિયન્ટ્સ સામે રક્ષણ આપવામાં ખૂબ અસરકારક હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે.

→અમેરિકાની NIHના જણાવ્યા અનુસાર કોવેક્સિન લેનારા લોકોના બીએલડી સિરમના બે પરીક્ષણ કરવામાં આવ્યા તે સૂચવે છે કે આ વેક્સિનથી જે એન્ટિબોડીનું નિર્માણ થાય છે તે અસરકારક રીતે કોવિડ-19ના બંને વેરિયન્ટ સામે રક્ષણ આપે છે.

→B.1.6.17 (ડેલ્ટા) વાઇરસ સૌથી પહેલા ભારતમાં અને B.1.1.7 (આલ્ફા) વાઇરસ બ્રિટનમાં મળ્યો હતો.

→ કોવેક્સિનના બીજા તબક્કાના પરિણામ સૂચવે છે કે તે સુરક્ષિત અને લેવામાં અનુકૂળ છે. વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલનું પરિણામ આગામી સમયમાં ઉપલબ્ધ બનશે.

→ દેશના વરિષ્ઠ હવામાન વિજ્ઞાનીઓના તાજા સંશોધન રિપોર્ટ અનુસાર ભારતમાં ગરમીથી 50 વર્ષમાં 17 હજાર લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત આંધ્રપ્રદેશ, તેલંગાણા, અને ઓરિસ્સામાં થયા છે.

→ ફ્રાંસે ભારત સાથે વિવાદાસ્પદ રૂ. 59,000 કરોડના રાફેલ ફાઇટર જેટ સોદામાં કથિત ભ્રષ્ટાચાર અને તરફેણવાદના આક્ષેપ સામે એક જજની નિમણૂક કરી ન્યાયિક તપાસ શરૂ કરી.

ટેક્સાસ હેલ્થ સાયન્સ સેન્ટરનો રિસર્ચ રિપોર્ટ

→કેન્સર સેલ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં કેન્સરના 95% દર્દીમાં કોવિડ-19ની mRNA વેક્સિનનો સારો ઇમ્યુન રિસ્પોન્સ જણાયો છે. ભારતીય મૂળના રિસર્ચના અભ્યાસ મુજબ વેક્સિનનો બીજો ડોઝ

લીધા બાદ ત્રણ-ચાર સપ્તાહમાં તેમના શરીરમાં એન્ટિબોડી બનવાની શરૂ થઈ હતી.

→ ફિલ્મ અભિનેતા આમિરખાન અને ફિલ્મ મેકર કિરણ રાવે લગ્નના 15 વર્ષ બાદ તેમના ડિવોર્સની જાહેરાત કરી. આમિરે 2005માં કિરણ રાવની સાથે લગ્ન કર્યા હતા અને 2011માં આઝાદ નામે દીકરાનો જન્મ થયો હતો. આ પહેલા આમિરે રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા જેનાથી ઇરા નામની દીકરી અને જૂનેદ નામનો દીકરો એમ બે સંતાનો હતા.

→ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)ના વિજ્ઞાનીઓના રિપોર્ટ અનુસાર મુંબઈ શહેરમાં 80% લોકો કોરોના વાઇરસ ના સંક્રમણમાંથી સાજા થઈ ચૂક્યા છે હવે આ લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ ચૂકી છે. આ સ્થિતિમાં મુંબઈમાં કોરોનાની ત્રીજી સંભવિત લહેર આવવાની શક્યતા ઘણી ઓછી છે. જો ત્રીજી લહેર આવે તો પણ તે બીજી લહેર જેવી ખતરનાક નહીં હોય.

→ જમ્મુ કાશ્મીરની બે રાજધાનીઓ શ્રીનગર અને જમ્મુ વચ્ચે દર છ મહિને થતી ' દરબાર મૂવ'ની 149 વર્ષ જૂની પ્રથાને બંધ કરવામાં આવી. 'દરબાર મૂવ' એટલે હવામાન બદલવાની સાથે દર છ મહિને જમ્મુ કાશ્મીરની રાજધાની પણ બદલાઈ જતી હતી. રાજધાની શિફ્ટ કરવાની આ પ્રથાને ' દરબાર મૂવ'ના નામે ઓળખવામાં આવે છે. આ પ્રથા બંધ થવાથી દર વર્ષે 200 કરોડ રૂપિયાની બચત થશે.'

→ કેન્દ્રિય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું જેમાં 12 મંત્રીઓએ રાજીનામા આપ્યા 33 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. નવા સહકાર

મંત્રાલયની રચના કરવામાં આવી તેના પ્રથમ મંત્રી અમિત શાહને સોંપવામાં આવ્યું.

- ▶ જેઈઈ મેઇનની ત્રીજા તબક્કાની પરીક્ષા 20 જુલાઇ થી 25 જુલાઇ 2021 અને ચોથા તબક્કાની 26 જુલાઇ થી બીજી ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવશે. જેઈઈ મેઇનના બાકીના તબક્કા માટે અરજી ન કરી શકનાર વિદ્યાર્થીઓને બીજી તક આપવામાં આવી.
- ▶ દિલ્હી મેટ્રોએ કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન પર ફાસ્ટેગ / યુપીઆઈ આધારિત કેશલેસ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી. આ દેશમાં પ્રથમ સેવા છે કે જેમાં પાર્કિંગ ચાર્જ ફાસ્ટેગ દ્વારા લેવામાં આવશે.
- ▶ આસામ રાજ્ય સરકારે બે બાળકો ધરાવતા પરિવારો માટે વિશેષ યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી જેમાં સ્વેચ્છિક નસબંધી કરનારાઓને આ પ્રકારની યોજનાનો બજેટમાં સમાવી લાભ આપવામાં આવશે.
- ▶ ઉત્તરપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા વસ્તી નિયંત્રણ કાયદો 11 જુલાઇ વિશ્વ વસ્તી દિનના રોજ લાગુ કરવાની જાહેરાત કરી. જેમાં એક સંતાન ધરાવનાર પર ટેક્સમાં છૂટ અને ફ્રી શિક્ષણનો સમાવેશ થાય છે. જ્યારે બેથી વધુ સંતાન ધરાવનારને સરકારી નોકરી તેમ જ કોઈપણ સરકારી સુવિધા ન આપવાની જોગવાઈ છે.
- ▶ કેન્દ્ર સરકાર કોરોના મહામારી સામે લડવા માટે 23,123 કરોડના પેકેજને મંજૂરી આપી જેમાં 15,000 કરોડ કેન્દ્ર સરકાર અને 8,000 કરોડની વ્યવસ્થા રાજ્ય સરકાર સહયોગ કરશે.
- ▶ ચૂંટણીપંચ દ્વારા વર્ષ 2011ની જનગણના આધારિત પરિસીમન આયોગ દ્વારા જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની સાત સીટ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ ડ્રાફ્ટ બાદ જમ્મુ કાશ્મીર

વિધાનસભાની 83 સીટો હતી તે વધીને 90 સીટો થશે.

- ▶ મુંબઈ હાઈકોર્ટે ' મહામાનવ શ્રીકૃષ્ણ' પુસ્તક ઉપર પ્રતિબંધ મૂક્યો. આ પુસ્તકનાં લેખક નગીનદાસ સંઘવી છે. આ પુસ્તક અંગે વિવાદ થતાં હાઈકોર્ટે પિટિશન થઈ હતી.
- ▶ આસામ સરકારે હિન્દુ, જૈન અને શીખની સંખ્યા ધરાવતા વિસ્તારો અને ધાર્મિક સ્થળોથી ગૌમાંસની દુકાનો દૂર કરવાની અને પાંચ કિલોમીટરના ક્ષેત્રની બહાર જ આવી દુકાન ખોલવા અંગે નવું વિધાયેક રજૂ કર્યું.
- ▶ કેન્દ્રિય નાગરિક ઉદ્યયન મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ડ્રોન પોલિસીનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો. નવી પોલિસી અંગેજનતાના સૂચનો મંગાવવામાં આવ્યા.એરસ્પેસને ત્રણ રેડ, યલો અને ગ્રીન ઝોનમાં વહેંચી ડ્રોન ઓપરેશન પ્રસ્તાવિક ડિજિટલ સ્કાય મેપ જાહેર કરવામાં આવ્યો છે.
- ▶ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતાના મતવિસ્તાર વારાણસીને 1583 કરોડની વિવિધ યોજનાઓની ભેટ આપી. 750 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને 840 કરોડની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો. વડાપ્રધાને વારાણસીમાં રુદ્રાક્ષ નામના સંમેલન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું જેનું નિર્માણ જાપાનની સહાયથી થયું છે.
- ▶ ભારતની પ્રસિદ્ધ મહિલા કલાકાર અમૃતા શેરગીલે 1938માં બનાવેલ પેઇન્ટિંગ ' ઇન ધ લેડીઝ એન કલોઝર' હરાજી દરમિયાન 37.8 કરોડ રૂપિયામાં (5.14 મિલિયન અમેરિકન ડોલરમાં) વેચાયું હતું.
- ▶ નાગરિક ઉદ્યયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંઘિયા દ્વારા કેન્દ્રની UDAN (ઉદે દેશ કા આમ નાગરિક) યોજના અંતર્ગત મધ્યપ્રદેશને મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે જોડતા 8 નવા રૂટ શરૂ કરવામાં આવ્યા.

- ▶ કેન્દ્રિય શિક્ષણ મંત્રી અને કેન્દ્રિય આદિજાતિ બાબતોના મંત્રી દ્વારા સંયુક્ત રીતે આદિજાતિ વિસ્તારોમાં શિક્ષકોને તાલીમ આપવા માટે શાળા ઇનોવેશન એમ્પ્રેસેડર તાલીમ કાર્યક્રમ (SITAP)ની સંયુક્ત રૂપે શરૂઆત કરવામાં આવી.
- ▶ નેશનલ મેડિકલ કમિશન (NMC)દ્વારા જારી કરવામાં આવેલ કંપલ્સરી રિટેટિંગ ઇન્ટર્નશીપ 2021 માટેના ડ્રાફ્ટ રેગ્યુલેશનમાં જણાવવામાં આવ્યું છે કે MBBSના વિદ્યાર્થીઓએ અન્ય પોસ્ટીંગની સાથે સાથે આયુષમાં પણ ઇન્ટર્નશીપ ટ્રેનિંગ લેવી પડશે.
- ▶ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડવાથી 50 લોકોના મોત થયા. જયપુરમાં આમેર મહેલ પર વીજળી પડી ત્યારે આ દરમિયાન વરસાદમાં સેલ્ફી લઈ રહેલા 35 લોકો ઝપટમાં આવ્યા હતા.
- ▶ ધો-12 પછી મેડિકલમાં પ્રવેશ પરીક્ષા નીટ (UG) 12 સપ્ટેમ્બરના રોજ યોજાશે. તથા
- ▶ દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતે પોતાનો રાજકીય પક્ષ ' રજની મક્કલ મંદરમ' ને વિખેરવાની જાહેરાત કરતાં કહ્યું કે ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશવાની તેમની કોઈ ઈચ્છા નથી.
- ▶ તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સોનાના ધરેણાં પર હોલમાર્કના ફરજિયાત નિયમના અમલીકરણનો પ્રથમ તબક્કો શરૂ થયો. પ્રથમ તબક્કામાં દેશના 256 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં તામિલનાડુના 24 જિલ્લાઓ, મહારાષ્ટ્રના 22 જિલ્લાઓ અને ગુજરાતના 23 જિલ્લાઓનો સમાવેશ થાય છે. 256 જિલ્લાના જવેલર્સ હવે 14, 18 અને 22 કેરેટના સોનાના દાગીના ફરજિયાતપણે હોલમાર્ક સાથે વેચવાના રહેશે.
- ▶ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું જેમાં 163 કરોડનું ડ્રગ્સ જપ્ત થયું છે. તેમણે ડ્રગ્સની હેરાફેરી કરતાં તસ્કરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.
- ▶ અધીર રંજન ચૌધરીને કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં પોતાના પક્ષના નેતા તરીકે વરણી કરી છે. જ્યારે ગૌરવ ગૌગોઈને તેમના ડેપ્યુટી તરીકે વરણી કરી છે.
- ▶ ભારત સરકારના આવકવેરા વિભાગે દેશના અગ્રણી મીડિયા ગ્રૂપ દૈનિક ભાસ્કરજૂથના ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં 30 કરતાં વધુ ઠેકાણા પર દરોડા પાડ્યા.
- ▶ મધ્યપ્રદેશ રાજ્યમાં મિશન ગ્રામોદયની યોજનાની શરૂઆત થઈ.
- ▶ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ની મુંબઈ કાઇમ બ્રાન્ચે પોર્ન ફીલ્મોના કથિત નિર્માણ અને પ્રદર્શનના આરોપસર ધરપકડ કરવામાં આવી. બ્રિટનની રજિસ્ટર્ડ પોર્ન નિર્માણ - વિતરણ કંપની કૅડિંગમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
- ▶ મધ્યપ્રદેશના નિવારી જિલ્લાના ઓરછા અને ગ્વાલિયર જિલ્લાના ગ્વાલિયરને યુનેસ્કોની ઐતિહાસિક શહેરોની યોજનામાં સામેલ કરવામાં આવ્યા. આ યોજનામાં ભારતના કુલ આઠ શહેરોનો સમાવેશ થયો છે.
- ▶ ભારતમાં સૌપ્રથમવાર બર્ડ ફ્લૂના સંક્રમણને કારણે દિલ્હીમાં એક વ્યક્તિનું અવસાન થયું. જે દેશમાં H5N1 વાયરસથી થનાર પ્રથમ મૃત્યુ છે. આ H5N1 વાયરસ મુખ્યત્વે મરઘાં અને અન્ય પક્ષીઓમાં જોવા મળે છે.
- ▶ આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા જમીન વિવાદમાં રાજ્યોની સરહદે વ્યાપક હિંસા થઈ છે

જેમાં પોલીસ જવાનો અને સ્થાનિકો દ્વારા એકબીજા પર કરેલ હુમલામાં છ પોલીસ જવાનોના મોત થયા છે.

- ▶ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા B. Techના અભ્યાસક્રમને ગુજરાતી સિવાય 11 પ્રાદેશિક ભાષાઓમાં શીખવવાની મંજૂરી મળી.
- ▶ કેન્દ્ર સરકારના આર્થિક સલાહકાર રહી ચૂકેલા અર્થશાસ્ત્રી અરવિંદ સુબ્રહ્મણ્યમ સહિતના સંશોધકો દ્વારા કરવામાં આવેલ બ્લૂમબર્ગ રિસર્ચના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના મહામારીમાં મોતનો આંકડો 13 થી 50 લાખ સુધીનો હોય શકે છે.
- ▶ યુનિક ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ જણાવ્યું છે કે પાંચ વર્ષથી નાના બાળકોના આધારકાર્ડ માટે ફિંગરપ્રિન્ટ અને આઇસ્કેનની આવશ્યકતા નથી. જો કે બાળક પાંચ વર્ષની થતાં જ તેના બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું રહેશે.
- ▶ કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી પદેથી ચેદિયુરપ્પાએ રાજીનામું આપ્યું. રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે લિંગાયત સમુદાયના બસવરાજ બોમ્મઈની વરણી કરવામાં આવી. ભારતમાં 100% પાઇપ સિંચાઈ પરિયોજના લાગુ કરવાનો શ્રેય તેમને જાય છે. બોમ્મઈ ચેદિયુરપ્પા મંત્રીમંડળમાં ગૃહ, કાડા અને સંસદીય બાબતોના મંત્રી હતા.
- ▶ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેંક્રપ્સી કોડ (સુધારા) બિલ 2021 સંસદમાં રજૂ કર્યું. કોરોના મહામારીના કારણે દેશના અર્થતંત્ર ઉપાચાર પડેલી આડઅસરોને

સુધારવા અને મંદ પડેલા વેપાર- ઉદ્યોગને ગતિ વધારવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે.

Gujarat/ગુજરાત

- ▶ અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલા કંપની નિર્મિત કોરોનાની રસી ઝાયકોવ-ડીને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ્સ કંટ્રોલર સમક્ષ મંજૂરી માગી. મંજૂરી મળતાં જ ભારતમાં 12 થી 18 વર્ષના બાળકોને રસી પણ આપી શકાશે.
- ▶ હાલોલના શિવરાજપુરના જીમીરાં રિસોર્ટમાં પોલીસે રેડ પાડતાં જુગાર અને દારૂની પાર્ટીમાં માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 લોકોને પોલીસે પકડી પાડ્યા. તમામ સામે જુગારધારા અને પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.
- ▶ રાજ્યમાં બાયોડીઝલના નામે અન્ય પ્રેટોલિયમ પેદાશોને ભેળવીને વેચવામાં આવતા ભેળસેળયુક્ત પદાર્થોનું વેચાણ તાત્કાલિક અટકાવવા માટે બાયોડીઝલના રિટેલ વેચાણ પર સરકારે પ્રતિબંધ મૂક્યો.
- ▶ રાજ્યના ઇતિહાસમાં પહેલી વખત 6 મહિલા ખેલાડીઓ ટોકિયો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. જેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનિસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પાઝલ પરમાર પેરા બેડમિન્ટનમાં ભાગ લેશે.

- ▶ ગુજરાત રાજ્યના પૂર્વ વન પર્યાવરણ અને આદિજાતિ વિકાસ મંત્રી રહેલા મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતમાંથી રાજ્યપાલ બનનાર પ્રથમ આદિવાસી નેતા છે.
- ▶ કેન્દ્રિય મંત્રીમંડળમાં ગુજરાતના બે મંત્રીઓ મનસુખભાઈ માંડવિયા અને પુરશોત્તમભાઈ રૂપાલાને પ્રમોશન આપી કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે ત્રણ નવા દર્શના જરદૌશી, ચૌહાણ દેવુસિંહ અને મહેંદ્ર મુજપુરાનો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો. મનસુખ માંડવિયાને આરોગ્ય અને કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રાલય અને પુરૂષોત્તમ રૂપાલાને મત્સ્ય અને પશુપાલન અને ડેરી મંત્રાલય આપવામાં આવ્યું.
- ▶ ટોકિયો ઓલિમ્પિક્સમાં સ્વિમરમાં ક્વોલિફાય થનાર ગુજરાતની માના પટેલ દેશની પ્રથમ મહિલા છે.
- ▶ સુરતમાં દેશનું પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટર શરૂ થયું. આ સેન્ટરમાં ઇ-કોમર્સની ઉપયોગિતા, જીએસટી, ટેક્સ અને શિપિંગ અને કેટેલોગ સહિતની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
- ▶ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી વર્ષ 2021-22થી ધો-10માં ગણિત વિષયના બે વિકલ્પ સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે પ્રકારના વિકલ્પ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ ગણિત રાખશે તે વિદ્યાર્થી જ ધો-11 સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે અને જે વિદ્યાર્થી બેઝિક રાખશે તે ધો-11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે નહીં. આ બંને વિકલ્પમાં ધો-10માં એક જ પુસ્તક રહેશે માત્ર

- વિકલ્પ પસંદ કરી વિદ્યાર્થી ધો-10 બોર્ડની પરીક્ષા આપવાની રહેશે.
- ▶ રાજકોટ એઇમ્સનો લોગો જાહેર, લોગોમાં ગુજરાતની કલા અને સાંસ્કૃતિક ધરોહરનો સમાવેશ થયો. લોગોમાં ગાંધી ચરખો, સ્ટેચ્યું ઓફ યુનિટી અને બાંધણી ડિઝાઇન તથા સિંહ અને દાંડિયાની પ્રતિકૃતિ દર્શાવે છે.
- ▶ સુરત મહાનગરપાલિકા દેશમાં ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ આપતી દેશની પ્રથમ મહાનગરપાલિકા બની.
- ▶ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોતાની કામગીરીનું જીવંત પ્રસારણ 19 જુલાઇ 2021ના રોજ કર્યું હતું. તમામ કામગીરી લાઇવ પ્રસારિત કરનાર દેશની પ્રથમ કોર્ટ બની.
- ▶ ગુજરાતમાં કોરોનાનનો કપ્પા વેરિયન્ટનો પ્રથમ કેસ ગોધરામાં નોંધાયો. અત્યારસુધીમાં ત્રણ જામનગર, એક ગોધરા અને એક મહેસાણા ખાતે કેસ નોંધાયેલ છે.
- ▶ અમદાવાદની CBSE શાળા ઉદ્દગમના વેક્સિનેશન પ્રોગ્રામ માટે ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારતની સૌપ્રથમ મહિલા સ્વિમર તરીકે પસંદગી પામનાર માના પટેલની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ઉદ્દગમ ગ્રૂપની ચાર શાળાઓમાં વેક્સિન લેનારા વાલીઓને ફીમાં 5% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
- ▶ ભાવનગરમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુખ્યમંત્રીના હસ્તે શરૂ કરવામાં આવી.

ખેલજગત

- ▶ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ ભારતીય રેસલર સુમિત માલિક પર સોફિયામાં આયોજિત ક્વોલિફિકેશન ઇવેન્ટમાં 125 કિલો કેટેગરીમાં ઓલિમ્પિક ટિકિટ મેળવી હતી પરંતુ ટોપ ટેસ્ટમાં નિષ્ફળ થયેલ સુમિત માલિક પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો.
- ▶ ભારતમાં 2022માં આયોજિત થનાર કોમનવેલ્થ આરચારી અને શૂટિંગ ચેમ્પિયનશિપ કોરોનાને કારણે રદ કરી દેવામાં આવી છે.
- ▶ જાપાનના ટોકિયો ઓલિમ્પિકની ઓપનિંગ (ઉદ્ઘાટન)સેરેમનીમાં સીએચએચ વખત ચેમ્પિયન બનનાર મેરિકોમ અને હોકી ટીમના સુકાની મનપ્રિત સિંહ ભારતની ધ્વજવાહક બનશે. મેરિકોમ ઓલિમ્પિકમાં ધ્વજવાહક બનનાર ભારતની પહેલી મહિલા બોક્સર બનશે. જ્યારે આ ગેમ્સની કલોર્જીંગ સેરેમનીમાં ધ્વજવાહક બનવાનું સન્માન પહેલવાન બજરંગ પુનિયાને મળશે.
- ▶ શ્રીલંકાના બેટ્સમેન સનત જયસૂર્યા સામે આઈસીસીની એન્ટિ કરપ્શન યુનિટ (ASU) દ્વારા સાત વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સનત જયસૂર્યા શ્રીલંકન ક્રિકેટ ટીમનો પર્ફોર્મન્સ એનાલિસ્ટ હતો ત્યારે તેણે શ્રીલંકન પ્રધાનને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ થયો હતો.
- ▶ ભારતમાં આગામી વર્ષ 2022માં યોજાનાર વિમેન્સ એશિયા કપ ક્રૂટબોલ ટૂર્નામેન્ટની યજમાનીમાં

અમદાવાદની બાદબાકી, હવે આ ટૂર્નામેન્ટની મેચો મુંબઈ અને પૂણેમાં રમાશે.

- ▶ ભારતીય મૂળના અમેરિકી ટેનિસખેલાડી 17 વર્ષીય સમીર બેનર્જીએ વિકટર લીવોલને હરાવી વિમ્બલ્ડનમાં જુનિયર બોયઝ સિંગલ્સનું ટાઇટલ જીત્યું. બેનરજીના માતા-પિતા 1980ના દાયકામાં અમેરિકામાં વસ્યા છે.
- ▶ કોપા અમેરિકા કપની ફાઈનલમાં આર્જેન્ટીનાએ બ્રાઝિલને 1-0થી હરાવી 28 વર્ષ બાદ ચેમ્પિયન બન્યું. આ ક્રૂટબોલ ટૂર્નામેન્ટના પ્લે ઓફ મુકાબલામાં પેરુને 3-2થી હરાવીને કોલંબિયા ત્રીજા ક્રમે રહ્યું. આર્જેન્ટીના આ અગાઉ 1993માં કોપા અમેરિકન કપ ચેમ્પિયન બન્યું હતું. માર્ટિનેઝનું ગોલ્ડન ગ્લોવ એવોર્ડ મેળવનાર પ્રથમ ગોલકીપર છે.લિયોનલ મેસી હેમસ્ટ્રિંગની ઇજા છતાં ફાઇનલ રમ્યો હતો. 2011 કલબ વર્લ્ડ કપ બાદ પ્રથમવાર બંને સામે સામે ટકરાયા હતા.
- ▶ વિમ્બલ્ડન વિમેન્સ ડબલ્સની ફાઈનલમાં બેલ્જિયમની એલિસ મર્ટેસ અને ચીનના તાઈપેની હસીહ સુ-વાઇની બનેલી વિશ્વની નંબર-3 જોડીએ રશિયાની વેરોનિકા કુડરમેતોવા અને એલેના વેસ્નિનાની જોડીને હરાવી વિમ્બલ્ડન વિમેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો.
- ▶ વિમ્બલ્ડન મેન્સ ડબલ્સની ફાઈનલમાં કોએશિયાના નિકોલા મેકિટક અને મેટ પેવીકની જોડીએ સ્પેનની માર્સેલ ગ્રેનોલર્સ અને આર્જેન્ટીનાના હોરાસિયો ઝેબાલોસની જોડીને હરાવી ચેમ્પિયન બની.

- ➔ ઓસ્ટ્રેલિયાની ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસ્કોવાને હરાવી પ્રથમ વખત વિમ્બલ્ડન-2021નું ટાઇટલ જીત્યું. 41 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ખેલાડી વિજેતા બની. આ અગાઉ એશ્લે બાર્ટીએ 2019માં ફ્રેંચ ઓપનનું ટાઇટલ જીત્યું હતું.
- ➔ સર્બિયાના ટોપ સિડ્ડે ખેલાડી નોવાક જોકોવિચે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઇટાલીના માટેઓ બેરેટીનીને હરાવી પોતાની કારકિર્દીનું છઠ્ઠું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું.
- ➔ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય રહી ચૂકેલા 36 વર્ષીય ફાસ્ટ બોલર પંકજ સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.
- ➔ લંડન ખાતે યોજાયેલ યુરો કપ -2020ની ફાઇનલમાં ઇટાલીએ પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને 3-2થી હરાવી બીજી વખત યુરો કપ ચેમ્પિયન બન્યું છે. પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડોએ યુરો કપમાં સૌથી વધુ ગોળ ફટકારવા બદલ ગોલ્ડન બૂટ એવોર્ડ વિજેતા જાહેર કરવામાં આવ્યા.
- ➔ વર્ષ 2021નો સ્કિપ્સ નેશનલ સ્પેલિંગ બી કંપિટિશનના 93માં એડિશનનો પ્રથમ પુરસ્કાર પ્રથમ વખત આફ્રિકન મૂળની અમેરિકી 14 વર્ષીય કિશોરી જાઇલા અવાંત ગાર્ડેએ જીતી લીધો છે. સાન ફ્રાન્સિસ્કોની 12 વર્ષીય ચૈત્રા થુમાલા બીજા સ્થાને અને ત્રીજા સ્થાને ન્યૂયોર્કની 13 વર્ષીય ભાવના મદીની આવી હતી.
- ➔ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં નવા ત્રણ સભ્ય મંગોલિયા, તાજિકિસ્તાન અને સ્વિઝરલેન્ડનો

સમાવેશ થયો. ICCમાં હવે કુલ 106 સભ્ય દેશો થયા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સ્થાપના 15 જૂન 1909ના રોજ થઈ હતી. અને તેનું મુખ્યાલય દુબઈ, સંયુક્ત આરબ અમીરાત આવેલું છે.

- ➔ ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રણ મેચોની વન ડે સિરીઝ ભારતે 2-1થી જીતી. પ્રથમ અને બીજી વન ડે મેચ ભારતે જીતી જ્યારે ત્રીજી અને અંતિમ વન ડે મેચ શ્રીલંકા જીત્યું હતું.
- ➔ ઇંગ્લેન્ડનો બેટ્સમેન લિયમા લિવિંગ્સ્ટોને ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ ત્રીજી ટી20 મેચમાં તેણે બોલર હારીસ રઉફના બોલમાં ફટકારેલો 122 મીટર દૂર જઈ પડ્યો હતો. આ પહેલા 121 મીટર લાંબા છગ્ગાનો વિક્રમ ઓસ્ટ્રેલિયાના ક્રિસ લિનના નામે હતો.
- ➔ હંગેરીમાં આયોજિત વિશ્વ ક્રેડેટ કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતની મહિલા ખેલાડી પ્રિયા મલિકે 75 કિલોગ્રામ કેટેગરીમાં બેલારૂસની પહેલવાનને 5-0થી હરાવી ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો.

ટોકિયો ઓલિમ્પિક -2020

- દિપક કાબરા ટોકિયો ઓલિમ્પિકમાં જિમ્નાસ્ટિક રમતના જજ બનનાર પ્રથમ ભારતીય બન્યા.
- ટોકિયો ઓલિમ્પિકમાં વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો.

→ પી.વી.સિંધૂ બેડમિન્ટનમાં ચીનની ખેલાડી હરાવી ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની બીજી મહિલા બની.

એવોર્ડ

- ઇસરોમાં ઇન્ડિયન સ્પેસ ઓલિમ્પિયાડ-2 ક્ષેત્રની પરીક્ષામાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે મેઘરજ તાલુકાના ગોઢા ગામની ત્વીષા પટેલને પદ્મશ્રી એવોર્ડ માટે નોમિનેટ થઈ, ઇસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટમાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલ યર્ચા વિચારણાઓ કરવા માટે પસંદગી પામી છે.
- તેલંગાણાની મનસા વારાણસીએ મિસ ફેમિના 2020નો ખિતાબ જીત્યો.

નિમણૂક/નિયુક્તિ

- ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામકપદનો ચાર્જ શાળાઓના કમિશનરની કચેરીમાં સંયુક્ત શિક્ષણ નિયામક તરીકે ફરજ બજાવતા એચ.એન.ચાવડાને સોંપવામાં આવ્યો છે.
- ગુજરાતના નવા પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે 1986 બેચના રવિન્દ્રકુમારને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

નવા આઠ રાજ્યોના રાજ્યપાલ

1. મધ્યપ્રદેશ - મંગુભાઈ પટેલ
2. હરિયાણા - બંદારૂ દત્તાત્રેય
3. કર્ણાટક - થાવરચંદ ગેહલોત
4. મિઝોરમ - ડૉ. હરિબાબુ કમ્ભાપતિ

5. હિમાચલપ્રદેશ - રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર
6. ગોવા - પી.એસ. શ્રીધર પિલ્લાઈ
7. ત્રિપુરા - સત્યદેવ નારાયણ આર્ય
8. ઝારખંડ - રમેશ બૈસ

- ઇડીના વેસ્ટર્ન રિજનના સ્પેશિયલ ડિરેક્ટરના વધારાનો ચાર્જ પ્રશાંતકુમારને સોંપવામાં આવ્યો છે. આ પહેલા ઇડીના વેસ્ટર્ન રિજનના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે સુશીલકુમાર કાર્યરત હતા જેમની નિમણૂક પેરન્ટ કેડર સીબીટીટીમાં ફરીથી કરવામાં આવી છે.
- વિશ્વની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોનના નવા સીઈઓ તરીકે એન્ડી જેસીની નિયુક્તિ કરવામાં આવી છે.
- અમદાવાદ કસ્ટમ અને સેન્ટ્રલ નવા કમિશનરના તરીકે શ્રી લલિત પ્રસાદની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ આ અગાઉ રાજકોટ સીજીટીએસટીમાં ફરજ બજાવતા હતા. જીતેશ નાગોરીની ડાયરેક્ટર જનરલ ઓડિટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગાંધીનગર ના સીજીટીએસટીના પ્રિન્સિપાલ કમિશનર તરીકે ચંદ્રકાંત વાલ્વેની નિયુક્તિ કરવામાં આવી છે.
- અમેરિકાની સોશિયલ મીડિયા જાયન્ટ કંપની ટ્વિટરના રેસિડેન્ટ ગ્રીવન્સ ઓફિસર તરીકે ભારતમાં વિનય પ્રકાશની નિયુક્તિ કરી છે.
- અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને લોસ એન્જેલસના મેયર તરીકે એરિક ગાર્સેટીને ભારતમાં અમેરિકાના નવા રાજદૂત તરીકે નોમિનેટ કર્યા છે. તેઓ

ભારતમાં અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટરનું સ્થાન લેશે.

- ▶ વિશ્વ હિન્દુ પરિષદના નવા અધ્યક્ષ તરીકે સર્જન ડોક્ટર રવિન્દ્ર નારાયણ સિંહની નિયુક્તિ કરવામાં આવી છે તેઓ ભૂતપૂર્વ ન્યાયાધીશ વિષ્ણુ સદાશિવ કોકજેનું સ્થાન લેશે.
- ▶ પંજાબ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નવજોતસિંઘ સિંઘની પસંદગી કરવામાં આવી છે. સંગતસિંઘ ગિલાજિયાન , સુખવિન્દ્રસિંઘ ડેની , પવન ગોયલ અને કુલજિતસિંઘ નાગરા સહિત ચાર નેતાઓને પંજાબ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
- ▶ ગુજરાત કેડરના 1984 બેચના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્લી પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અસ્થાના બીએસએફના ડીજીપી હતા અને તેઓ 31 જુલાઇના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ તેમણે દિલ્હીના કમિશનર બનાવવામાં આવ્યા છે.

વિજ્ઞાન ટેકનોલોજી

- ▶ વર્જિન ગેલેક્ટિક કંપનીના માલિક રિચર્ડ બ્રેનસન 11 જુલાઇના રોજ સ્પેસ મિશન સફળ રહ્યું. આ ઉડાન ભર્યાના એક કલાક, પાંચ મિનિટ પછી તેઓ એતિહાસિક યાત્રા કરીને પૃથ્વી પર પરત ફર્યા હતા. દરમિયાન તેમની સાથે મૂળ ભારતીય અને આંધ્રપ્રદેશમાં જન્મેલી શ્રીશા બાંદલા પણ યાત્રા પર ગઈ હતી. 33 વર્ષીય શ્રીશા બાંદલા કંપનીમાં સરકારી બાબતોના અધિકારી છે. અંતરીક્ષની સફર

પર જનાર તે ભારતીય મૂળની બીજી મહિલા અને ચોથા ભારતીય બન્યા હતા.

- ▶ ચીનના બે અંતરિક્ષયાત્રીઓનું નવા સ્પેસ સ્ટેશનના 15 મીટર લાંબા રોબોટિક આર્મ બનાવ્યું અને સ્પેસ સ્ટેશન બહાર પહેલીવાર સફળ સ્પેસવોક કર્યું.
- ▶ હવામાનની સચોટ આગાહી માટે ચીને નવો ઉપગ્રહ Fengyun-3E લોન્ચ કર્યો.
- ▶ ભારતીય સંશોધકોએ સુપરલ્યુમિન્સ સુપરનોવાની શોધ કરી. આ સુપરનોવા બીજા કોઈ ચમકીલા તારાથી પ્રકાશિત છે જેને દેવસ્થળ ઓપ્ટિકલ ટેલિસ્કોપ અને અન્ય બે ટેલિસ્કોપની મદદથી શોધવામાં આવ્યો છે. આ સુપરનોવાનું મેઝેટિક ફિલ્ડ ખૂબ જ શક્તિશાળી છે.
- ▶ ભારતના સંશોધકોએ ખાસ પ્રકારનો ખૂબ જ ચમકતો અને વિશેષ પ્રકારના ન્યૂટ્રોન તારામાંથી ઊર્જા લેતો સુપરનોવા શોધી કાઢ્યો છે. આ સુપરનોવા ખૂબ જ પાવરફૂલ મેઝેટિક ફિલ્ડ ધરાવે છે અને પ્રાચીન તત્વોના ઊંડાણપૂર્વકના અભ્યાસથી બ્રહ્માંડના સદીઓ પુરાણા રહસ્યો શોધવામાં મદદ કરશે.
- ▶ લક્ઝરી કાર ઉત્પાદક બીએમડબલ્યુએ તેનું પ્રથમ ઇ-સ્કૂટર સીઇ-04 રજૂ કર્યું છે. તે એકવાર ચાર્જિંગમાં 130 કિમી ચાલશે.
- ▶ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગરના સંશોધકોની ટીમે એક એન્ટિવાયરલ સરફેસ કોટિંગ મટિરિયલ્સ વિકસાવ્યું છે જે નોન-પેથોજેનિક વાયરસ પર ખૂબ અસરકારક છે, સાથે

જ બિન-ઝેરી, પર્યાવરણ ને અનુકૂળ અને પારદર્શક છે.

- ▶ DRDO દ્વારા એન્ટિ ટેન્ક મિસાઇલ આકાશનું ઓડિશા ખાતેની પરીક્ષણ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આકાશ મિસાઇલ ઓછી વજન ધરાવતી 70 કી.મી દૂર સુધી ટાર્ગેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ ' આત્મ નિર્ભર ભારત' કેમ્પિંગ હેઠળ તૈયાર કરવામાં આવી છે.
- ▶ અમેરિકન સંસ્થા નાસા દ્વારા ચંદ્રની ભ્રમણ કક્ષા ડગવાથી વર્ષ 2030 સુધીમાં પૃથ્વી પર વિનાશક પૂર આવવાનું તારણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. નાસા મુજબ વર્ષ 1728માં ચંદ્રનું ભ્રમણ કક્ષામાંથી ડગવું પ્રથમ વખત જાણવા મળ્યું હતું. જે લગભગ 18.6 વર્ષનું પ્રાકૃતિક વ્હાકરા હોય છે.
- ▶ વિશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ એલન મસ્ક સ્પેસ ટુરિઝમ ક્ષેત્રે તેમની કંપની સ્પેસએક્સનું અંતરિક્ષયાન ' સ્ટારશિપ એસએન-20' ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પોતાના પહેલા પરીક્ષણ માટે ઉડાન ભરશે.

સંરક્ષણ

- ▶ ભારત પોતાના મહત્વના સૈન્ય છાવણીઓ પર વાયુસેના દ્વારા 10 એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ એરબેઝ પર હવાઈ હુમલા બાદ સતર્કતા વધારવાનો સરકારે નિર્ણય કર્યો.
- ▶ રશિયાનું AN-26 વિમાન રશિયાની પૂર્વે આવેલા કામચટકા દરિયાથી ઘેરાયેલા શિખર વિસ્તારમાં

પેટ્રોપાવલોવ્સ્કીથી રવાના થયા પછી કેશ થતાં પાયલોટ્સ સહિત 28 પ્રવાસીઓના મોત થયા.

- ▶ ભારત- અમેરિકાએ સંરક્ષણ ભાગીદારી મજબૂત બનાવવા અમેરિકી નૌકાદળે પ્રથમ એમએચ -60 આર મલ્ટી રોલ હેલિકોપ્ટર ભારતીય નૌકાદળને પ્રથમ જથ્થો સોંપ્યો.
- ▶ ભારત અને બ્રિટનના નૌકાદળ દ્વારા બંગાળના અખતમાં સંયુક્ત યુદ્ધ ક્વાયટ ' કોંકણ ક્વાયટ' શરૂ થઈ. આ યુદ્ધ અભ્યાસમાં બ્રિટનનું સૌથી મોટું યુદ્ધ જહાજ ' કવિન એલિઝાબેથ' ભાગ લીધો હતો. આ અભ્યાસમાં બંને દેશોના 10 યુદ્ધ જહાજ, 2 સબમરીન, 20 યુદ્ધ વિમાન અને 9000 હજારથી વધુ સૈનિકોએ ભાગ લીધો.
- ▶ ભારત અને ફ્રાન્સની નેવીનો બે દિવસીય બિસ્કેની ખાડીમાં યુદ્ધાભ્યાસ સંપન્ન થયો. આ યુદ્ધ અભ્યાસમાં
- ▶ ભારતીય સેનાનું યુદ્ધજહાજ INSTabar તેમજ ફ્રાન્સની નેવીનું જહાજ Aquitaine અને ચાર રાફેલ યુદ્ધવિરામએ ભાગ લીધો હતો.
- ▶ ફ્રેંચ કંપની Carmetવિશ્વનું પ્રથમ કૃત્રિમ હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે વેચાણ કર્યું. કૃત્રિમ હૃદયનું વેચાણ ઇટાલિયન દર્દીને કરવામાં આવ્યું જે હૃદયનું ઓપરેશન હાર્ટ સર્જન ડૉ. સીરો માઈલોની આગેવાની ધરાવતી ટિમ દ્વારા નેપલ્સની એઝીન્ડા ઓસ્પેડા

ગુજરાતી કલાકાર અરવિંદ રાહોડ



ગુજરાતી નાટ્યમંચ અને ચલચિત્ર જગતના જાણીતા અભિનેતા અરવિંદ રાહોડનું હાર્ટએટેકથી 80 વર્ષની વયે પહેલી જુલાઈ 2021ના રોજ અમદાવાદ ખાતે થયું.

- ➔ તેઓ 12 વર્ષ નકલી નામ રાજેશકુમારના નામથી ફિલ્મોમાં કામ કર્યું.
- ➔ ગુજરાતી ફિલ્મોના વિલન અભિનેતા તરીકે ઓળખાતા અરવિંદ રાહોડે 46થી વધુ ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી.
- ➔ તેમણે ' ભાદર તારા વહેતા પાણી', ' સન કંસારી', ' ગંગાસતી', ' મા ખોડલ તારો ખમકારો' જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
- ➔ ગુજરાતી ઉપરાંત હિન્દી ફિલ્મો જેવી કે ' મેરા નામ જોકર', ' કોરા કાગઝ', ' અઝ્મિપથ', ' ખુદાગવાહ' ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

ફિલ્મ પ્રોડ્યુસર રાજ કૌશલ



બોલિવુડના જાણીતા ડિરેક્ટર, પ્રોડ્યુસર અને અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું 49 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટને કારણે 30 જૂનના રોજ અવસાન થયું.

- ➔ મંદિરા બેદી અને રાજ કૌશલે 1999માં લગ્ન કર્યા હતા. તેમને તારા અને વીર બે સંતાન છે. તારાને 2020માં દત્તક લીધી હતી.

- ➔ 1998માં તેમણે પોતાની એડ્વર્ટાઇઝીંગ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. અને 800થી વધુ એડ્ઝને ડિરેક્ટ કરી હતી.

એક્ટિવિસ્ટ ફાધર સ્ટેન સ્વામી



મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવ હિંસાના કેસમાં ધરપકડ કરાયેલાભારતના માનવાધિકાર કાર્યકર ફાધર સ્ટેન સ્વામીનું 84 વર્ષની વયે 6 જુલાઈના રોજ મુંબઈની તળોજા જેલમાં અવસાન થયું.

- ➔ પહેલી જાન્યુઆરી 2018ના રોજ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મરાઠાઓ વચ્ચે થયેલા યુદ્ધની 200મી વર્ષગાંઠની ઉજવણી વખતે ભીમા-કોરેગાંવમાં હિંસા ફાટી નીકળી હતી.
- ➔ ભીમા- કોરેગાંવમાં હિંસા કેસમાં NIAએ આરોપ લગાવ્યો હતો કે સ્ટેનના નકસલીઓ સાથે સંબંધ છે અને તેઓ પ્રતિબંધિત માઓવાદી સંગઠનના સંપર્કમાં છે.
- ➔ આદિવાસી અને દલિતોના અધિકાર માટે લડનારા લડાયક આગેવાન હતા.

ફિલ્મ અભિનેતા દિલીપ કુમાર



ભારતીય સિનેમાના ટ્રેજેડી કિંગ અભિનય સમ્રાટ દિલીપકુમાર મોહમંદ યુસુફખાનનું 7 જુલાઈ 2021ના રોજ 98 વર્ષની વયે અવસાન થયું.

- ➔ પોતાની કારકિર્દીની શરૂઆત ઇ.સ. 1944માં

‘જવારભાટા’ નામની હિન્દી ફિલ્મમાં ‘ જગદીશ’ના પાત્રના અભિનયથી કરી હતી.

- ➔ દિલીપકુમાર રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ થયા હતા.
- ➔ દિલીપકુમાર સૌપ્રથમ અભિનેત્રી કામિનિ કૌશલ સાથે પ્રેમમાં હતાં, પણ તેઓ તેણીના લગ્ન તેની સ્વર્ગવાસી બહેનનાં પતિ સાથે થવાથી પરણી ન શક્યાત્યારબાદ તેઓ મધુબાલા સાથે પ્રેમ સંબંધોમાં હતા, પરંતુ પરિવારના વિરોધના કારણે તેમનું લગ્ન ન થઈ શક્યું.
- ➔ તેઓએ ૧૯૬૬માં અભિનેત્રી અને સૌંદર્ય સામ્રાજી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા, જે તેમનાથી ૨૨ વર્ષ નાની હતી. તેઓએ ૧૯૮૦માં અસ્મા સાથે બીજા લગ્ન કર્યા પણ આ લગ્ન વધુ સમય ટક્યા નહીં.
- ➔ તેમણે ‘ સુપ્રસિદ્ધ ‘ સૌદાગર’, ‘ દેવદાસ’, ‘ હલચલ’, ‘ આરઝુ’, ‘ પ્રતિમા’, ‘ ઉડન ખટૌલા’, ‘ અંદાઝ’, ‘ મધુમતી’ જેવી ૬૦થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
- ➔ તેમને ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા.

હોકી ખેલાડી કેશવ દત્ત



ઓલિમ્પિકમાં ભારતને ૧૯૪૮ અને ૧૯૫૨માં બે વખત હોકી ગોલ્ડ મેડલ અપાવનાર ગોલ્ડ મેડાલિસ્ટકેશવ દત્તનું ૯૫ વર્ષની વયે કોલકાતા સંતોષપુરમાં પોતાના નિવાસસ્થાને

અવસાન થયું.

- ➔ તેઓ આઝાદ ભારતની પ્રથમ ઓલિમ્પિક હોકી ટીમના સભ્ય હતા.
- ➔ દેશભક્ત કેશવ દત્તની સૌથી મોટી સિદ્ધિ એ હતી કે ભારત અને ચીન વચ્ચે યુદ્ધમાં તેમણે પોતાના મેડલ ભારતીય સેનાને ફંડ માટે દાનમાં આપ્યા હતા.

પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડૉ. પી.કે. વોરિયર



દેશના પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય અને કેરળની સારવાર પદ્ધતિને પરંપરાગત રીતે લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર ડૉ. પી.કે. વોરિયરનું ૧૦૦ વર્ષની વયે અવસાન થયું.

- ➔ આર્ય વૈદ્ય શાળાના સ્થાપક વૈદ્યરત્ન પી.એસ. વોરિયરના ભત્રીજા હતા. ડૉ. વોરિયરે વર્ષ ૨૦૦૮માં પોતાની આત્મકથા ‘ સ્મૃતિ પર્વમ’ને કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૦માં ધનવંતરી પુરસ્કાર પણ એનાયત થયેલ છે.

હોરર ફિલ્મની શરૂઆત કરનાર કુમાર રામસેનું

- ➔ ભારતમાં હોરર ફિલ્મની શરૂઆત કરનાર કુમાર રામસેનું ૮૫ વર્ષની વયે આઠમી જુલાઈ ૨૦૨૧ના રોજ કાર્ડિયાક એરેસ્ટના કારણે અવસાન થયું.
- ➔ રામસે બ્રધર્સે ઇન્ડિયન સિનેમામાં હોરર એમ્પાયર સર્જ્યું હતું.
- ➔ તેમણે ‘ પુરાના મંદિર’, ‘ સાયા’ અને ‘ ખોજ’ સહિત અનેક ફિલ્મોની સ્ક્રીપ્ટ્સ લખી હતી.

- ▶ 1970માં ' એક નહી મુઝી સી લડકી' ને મળેલા ઓડિયન્સના રિએક્શન્સ જોયા પછી ઈંડિયામાં હોરર ફિલ્મ કલ્ટની શરૂઆત કરી હતી.

નાટ્યકાર ઊર્મિલકુમાર થપલિયાલ



સુપ્રસિદ્ધ નાટ્યકાર ઊર્મિલકુમાર થપલિયાલનું 80 વર્ષની વયે અવસાન થયું. તેઓએ લગભગ 95થી વધુ

નાટકો લખ્યા હતા.

- ▶ તેમણે આકાશવાણીમાં નાટ્યમંચની જેમ નાટક પ્રસ્તુત કરવાની પરંપરા શરૂ કરી હતી. વર્ષ 1972માં ' દર્પણના સંસ્થાપક બન્યા.
- ▶ તેમને સંગીત નાટક અકાદમી અને યશ ભારતી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
- ▶ વર્ષ 2013માં અદ્વૈત શિખર સન્માન એનાયત કરવામાં આવેલ છે.

ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકી



ભારતના પ્રતિભાશાળી ફોટોજર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીનું અફઘાન લશ્કર અને તાલિબાનો વચ્ચે થયેલા સંઘર્ષનું કવરેજ

કરતી વખતે હત્યા કરવામાં આવી.

- ▶ વર્ષ 2018માં ફીચર ફોટોગ્રાફી માટે પ્રતિષ્ઠિત પુલિત્ઝર એવોર્ડથી સન્માનિત દાનિશ સિદ્દીકી રોઈટર્સ સંસ્થા સાથે જોડાયેલ હતા.

'દાદી સા' સુરેખા સિકરી



હિન્દી સિરિયલ ' બાલિકા વધૂ'માં ગ્રાન્ડમધરના રોલથી લોકપ્રિય બનેલા અને ત્રણ વખત નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી સુરેખા સિકરીનું 75

વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટના કારણે અવસાન થયું. સુરેખા સિકરીને 2019માં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો.

- ▶ તેઓ ફેમિલી કોમેડી શો ' જસ્ટ મહોબ્બત'થી ઘરઘરમાં જાણીતા બન્યા તે પછી તેઓ ' ઝૂબેદા ' અને ; મિસ્ટર એન્ડ મિસીસ અચ્ચર' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
- ▶ વર્ષ 2018માં આયુષમાન ખુરાણાની ' બધાઈ હો'થી બિગ સ્ક્રીન પર ફરી જોવા મળ્યા હતા.
- ▶ 1994માં ફિલ્મ ' મમ્મો'એ પણ નેશનલ એવોર્ડ જીત્યો હતો.

સૌથી વૃદ્ધ શાળાની વિદ્યાર્થિની ભાગીરથી અમ્મા



વિશ્વમાં સૌથી વૃદ્ધ શાળાની વિદ્યાર્થિની ભાગીરથી અમ્માનું કેરળમાં 107 વર્ષની વયે અવસાન થયું. તેઓ ધો-5 પાસ થયા હતા તેમનું સપનું

હતું કે તેઓ ધો-10ની પરીક્ષા પાસ કરે.

- ▶ તેમણે ધો-5 પાસ કર્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમ ' મન કી બાત'માં પણ તેમનો ઉલ્લેખ કર્યો હતો.
- ▶ વર્ષ 2019માં કેરળ રાજ્ય સાક્ષરતા મિશન દ્વારા આયોજિત ધો-4 પરીક્ષા પાસ કરી સૌથી મોટી ઉંમરના છાત્ર બની ઇતિહાસ રચ્યો હતો.

- તેઓ કેરળ રાજ્ય શિક્ષણ અભ્યાસના પોસ્ટર ગર્લ હતા અને વર્ષ 2019માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ' નારી શક્તિ પુરસ્કાર'થી સન્માનીત કરવામાં આવ્યા હતા.

પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ



હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજનું વડોદરાની ભાઇલાલ અમીન

હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 27 જુલાઇના રોજ 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

- તેઓ પ્રમુખ સ્વામી મહારાજના ગુરૂ ભાઈ હતા. તેમની અંતિમ વિધિ પહેલી ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી.